



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૪/૦૮/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૧૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૨ કેસ કરી, ૩૭ વ્યક્તિઓને ઝડપી, ૧૧૫ લીટર દેશી દારૂ અને ૧૧ બિયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૦૩ કેસ કરી, ૧૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭,૫૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૧૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૦૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૩૧૩/૧૯

**નરોડા :** રાજેશભાઈ રામજીભાઈ પ્રજાપતિ (ઉ.વ.૩૪)(રહે.પેરેડાઇઝ પાર્ક ફ્લેટ નરોડા સ્મશાન ચાર રસ્તા પાસે નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૨/૦૮/૨૦૧૯ રાતના ૯/૩૦ થી તા.૦૩/૦૮/૨૦૧૯ સવારના ૮/૪૫ વાગ્યા દરમિયાન નરોડા પેરેડાઇઝ પાર્કમાં બહારની બાજુએ રોડ ઉપર આવેલ દુકાન નંબર બી/૨ “દેવ સેલ્સ એજન્સી” નામની પોતાની પતંજલી આયુર્વેદિક દવાની દુકાનનું શટલ ઉંચુ કરી, અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી, ટેબલનાં ડ્રોવરમાંથી રોકડ રૂપિયા ૪૮,૦૦૦/- તથા ટેબલની ફાઇલ નીચે મુકેલ રોકડ રૂપિયા ૬૮,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૧૬,૦૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.કે.મોરી ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૧૩૧૪/૧૯

**નરોડા :** મીનાબહેન વા/ઓ રમેશભાઈ પ્રજાપતિ (ઉ.વ.૩૫)(રહે.ગોપાલનગર સોસાયટી વિભાગ-૨ ગોકુળધામ સોસાયટીની બાજુમા નાના ચીલોડા નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૮/૨૦૧૯ ના કલાક ૧૨/૧૫ વાગ્યાના સુમારે નરોડા સુતરના કારખાના ત્રણ રસ્તા નજીક રોડ ઉપર મીનાબહેન રીક્ષામાંથી નીચે ઉતારતા હતા ત્યારે રિક્ષામા બેસેલ ત્રણ અજાણ્યા પુરુષ (૨૪ થી ૩૫ વર્ષના આશરાના) ભેગામળી મીનાબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.કે.મોરી ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૩૧૫/૧૯

**ખાડીયા :** જીજ્ઞાબહેન વા/ઓ જીજ્ઞેશભાઈ શાહ (ઉ.વ.૪૫)(રહે.એલ.આઇ.જી-૧૪ શીવાલય એપાર્ટમેન્ટ મુખ્યમંત્રી આવાસ યોજના સફલ-૩ ની બાજુમાં કાંકરીયા રોડ) એ ખાડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૮/૨૦૧૯ બપોરના ૩/૦૦ થી ૪/૦૦ વાગ્યા દરમિયાનમા મણીનગર રૂટની બીઆરટીએસ બસમાં ગોતા ચોકડી થી ગોળલીમડા બીઆરટીએસ બસ સ્ટેન્ડ સુધીની મુસાફરી દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ ભીડમા જીજ્ઞાબહેનની નજર ચુકવી તેમના ખભે ભરાવેલ લેડીઝ પર્સની ચેઇન ખોલી, પર્સમાંથી સોનાના પાટલા નંગ-૨ કિંમત રૂપિયા ૧,૮૦,૦૦૦/-, સોનાના કડા નંગ-૨ કિંમત રૂપિયા ૯૦,૦૦૦/-, સોનાની બંગડી કિંમત રૂપિયા ૩૫,૦૦૦/-, મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૧,૫૦૦/- અને રોકડ રૂપિયા ૬,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩,૨૨,૫૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.કે.ગોસ્વામી ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૩૧૬/૧૯

**વટવા :** પ્રિતીલતા ડો/ઓ રાજુસિંગ કુશ્વાહ (ઉ.વ.૧૯)(રહે.કિર્તીકુંજ સોસાયટી અક્ષરધામ સોસાયટી પાસે બચુભાઇનો કુવો વટવા) એ અગમ્ય કારણસર તા.૦૩/૦૮/૧૯ સવારના ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરની છતની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી જે.વાય.ચૌહાણ ચલાવે છે.

**પાલડી :** અનીલકુમાર સ/ઓ બાબુભાઇ જોષી (ઉ.વ.૭૬)(રહે.યોગેશ્વરનગર સોસાયટી, પાલડી ભક્ષા બસ સ્ટોપ સામે પાલડી) એ અગમ્ય કારણસર તા.૨૫/૦૭/૧૯ ના કલાક ૧૧/૦૦ થી ૧૨/૦૦ વાગ્યા દરમિયાન પોતાના ઘરે કબાટમાં પડેલ ફીનાઇલ કે મચ્છર મારવાની ઓલઆઉટ પી લેતા, સારવાર માટે તેમને ડો.જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિષ્ક્રમ્ય હતું. આ અંગે પાલડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી પ્રદ્યુમનસીંહ જટુભા ચલાવે છે.

**ગોમતીપુર :** કિરીટભાઇ આલજીભાઇ સોલંકી (રહે.મ્યુ. સિલ્વર સ્ટાફ ક્વાર્ટર્સ બીજા માળે ગોમતીપુર) એ અગમ્ય કારણસર તા.૦૩/૦૮/૧૯ ના કલાક ૧૦/૪૫ વાગ્યા પહેલા કોઇપણ સમયે મ્યુ.સિલ્વર સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડીંગના ધાબા ઉપર પાઇપ સાથે નાઇલોનની દોરી બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રાજેશકુમાર પ્રભુદાસ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.